



ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત

આયોગ દ્વારા આપવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પ્રાથમિક કસોટી માટે ઓગસ્ટ-૨૦૧૭ દરમિયાન ગાંધીનગર/અમદાવાદના વિવિધ પેટાકેન્દ્રો ખાતે યોજનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક કસોટીના અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ક્રમ	જગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	પ્રાથમિક કસોટીની તારીખ અને સમય (૪)
(૧)	(૨)	(૩)	(૪)
૧	જિલ્લા યુવા વિકાસ અધિકારી વર્ગ-૨ (સામાન્ય રાજ્ય સેવા વર્ગ-૨)	૧૨૪/૨૦૧૬-૧૭	૨૦/૦૮/૨૦૧૭ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦
૨	મદદનીશ સંશોધન અધિકારી, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-૨ (ન.જ.પા.પૂ. અને ક.વિ.)	૧૨૯/૨૦૧૬-૧૭	૨૦/૦૮/૨૦૧૭ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦
૩	જુનિયર સ્થપતિ, વર્ગ-૨ (માર્ગ અને મકાન વિભાગ)	૦૯/૨૦૧૬-૧૭	૨૦/૦૮/૨૦૧૭ બપોરે ૦૩:૩૦ થી ૦૫:૧૦
૪	ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર હેઠળ કાયદા અધિકારી, વર્ગ-૨	૪૩/૨૦૧૫-૧૬	૨૦/૦૮/૨૦૧૭ બપોરે ૦૩:૩૦ થી ૦૫:૧૦

જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ છે તેવા તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉમેદવારોએ તા.૦૪/૦૮/૨૦૧૭ના રોજ બપોરના ૧-૦૦ કલાકથી પરીક્ષાના દિવસે જા.ક. ૧૨૪/૧૬-૧૭ અને જા.ક. ૧૨૯/૧૬-૧૭ માટે સવારના ૯-૦૦ કલાક સુધીમાં તથા જા.ક. ૦૯/૧૬-૧૭ અને જા.ક. ૪૩/૧૫-૧૬ માટે બપોરના ૧-૩૦ કલાક સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્રક તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) "Online" ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્તેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) <https://gpsc-ojas.gujarat.gov.in/> પર જવું. (૨) "Print Call Letter" પર "Click" કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની "Job Select" કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે "Print Call Letter" પર "Click" કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરીપત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર "Click" કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરીપત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટાવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસ નોંધ:- (૧) પોસ્ટ ઓફિસમાં અરજી ફી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: છ-૩ સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર "Application Not Found" નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

તા. ૦૪-૦૮-૨૦૧૭